2010 Before -Satpanth Manuscript 15 -Satgor Brahma Vacha (165)




realpatidar.com
realpatidar.com



જનમતારીક ભાઈ/બેના
પ્રેમજીભાઈ/નો જનમતારીક
સવંત ૨૦૦૨) ના સરાવણ (સુદ ૬) વાર રવીવાર
૨) મનજીભાઈ નો જનમ
સવંત ૨૦૦૫) ના અસાડ સુદ ૧૩ વાર સોમ
(૩) [illegible] નો જનમ
સવંત ૨૦૨૨ ના મહા વદ ૭)
~~સવંત ૨૦૧૫) ના વૈશાખ~~
~~જાડુના જનમતારીક સવંત~~ તા-૧૮-૫-૫૯ ના રાતે
સુદ ૧૧) વાર ભોમે ના-૧
૧૧-૫) વાગે જનમ થએઓ છે
~~છોકરો મનસુખલાલ નો જનમતારીક સવંત~~
૨૦૨૮) ના જેઠ વદ ૪ ના રાતે પાના દીવસના
૩) ફરાકે જનમ થએઓ છે તા-૨૧-૬-૬૨ના
~~જનતા નો જનમ ૨૦૨૦ ના [illegible]~~
~~[illegible] જનમ થએઓ છે~~
ને વાર લોમે નો જનમ થએઓ છે
~~છોકરી [illegible] નો જનમતારીક સવંત~~
સવંત ૨૦૨૫) ના ચૈત્ર વદ ૨૦) ને રવીવારના
રાતે ૨૦ વાગે
ફરાનો જનમ ૨૦ ના [illegible] તારીખ ૧૨ પાવ દ ૨૦
રાતના ૮ વાગે ફરાકે
થએઓ છે

~~ડુભાબીજનગ તારીકલે બેઠ~~
સંવત ૨૦૨૯ ના ભાદરવા વદ ૧૦ ને રોજ
બપોરે ૮ - ડુભાકુંવ ઓછે વી ના ઈના રોજ

~~ડાઈ મોટા રેવુરા દસમી જાગને બેસા વાર~~
ના જનમતારીકલે બાદ સંવત ૨૦૩૨ ના ચૈત્ર વ
ડાઈ ૨૬૨૫ નાગડુવાર તા-૨૪-૧૦-૭૫ ના રો
બેસવારેના જ વાગેન નાપ ઓછે તેના
ડાગરેતા

~~મેરૂ લખમાન ના જાનમો~~
વાછે સંવત ૨૦૩૪ ના ફાગણ વદ ૨, નાગડુવા
ના મ રાગ છે
તા. ૨૫-૪-૭૮

~~જાપુરાણી નાગ છ બા~~
જાન ડુ ના જ નનારીક
ડાગીજનનામ નાજ દેવશા કુંવર
સંવત ૨૦૩૫ ના વૈશાખ
વદ ૬ ૨૨. તા. ૨૨-૫-૭૯
સવારે

(९)

सतगोर [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

સુનાનલ॥ ગાકુરલ॥ લદુદા॥ લા
અલાહા॥ ઇલલલલાહા સુનાનલ॥
ચપીલુલ ફકીલા॥ લઅલાહા॥ ઇ
લલલલાહા॥ સુનાનર॥ રફી ખુલ
ઠ ખીજા॥ લાઅલાહા॥ ઇલલલલા
હા॥ સુનાનદ॥ દાઅજુલ॥ કાઅ
નો॥ લાઅલાહા॥ ઇલલલલાહા॥ સુ
નાનલ॥ ના હા ચીલ॥ નાના તો॥
લાઅલાહા॥ ઇલલલલાહા॥ સુનાન
લ॥ હૈવુલ॥ કૈયુ નો॥ લાઅલાહા

ઈલલલલાહો સુભાનલ ખાલિકુલ
ખારીઆ। લા અ લાહાં। ઈલલલલાહો
સુભાનલ: અલીમુલ અજીબા:।
લા અ લાહાં। ઈલલલલાહો સુભાનલ
ખાફિદુલ અફદો। લા અ લાહાં। ઈલ
લલલાહો સુભાનલ। મુજીબીલ મ
હા જીબા। લા અ લાહાં। ઈલલલલાહો
સુભાનલ હબાબુસ સફાદો। લ
અ લાહાં। ઈલલલલાહો સુભાનલ
હલીમુલ ફરીજી। લા અ લાહાં।

(3)

ઈલલલલાહા ॥ સુભાનલ ॥ અપૈ ઝુલ
ફરી મો ॥ લાઅલાહા ॥ ઈલલલલાહા ॥
સુભાનલ ॥ અપૈ ઝુલ ॥ આખેરી ॥
લાઅલાહા ॥ ઈલલલલાહા સુભાન
લ માહરાલ ॥ માતનો ॥ લાઅલાહા
ઈલલલલાહા ॥ સુભાનલ ॥ કુભારલ ॥
મીત અંા લો ॥ લાઅલાહા ॥ ઈલલલ
લાહા ॥ સુભાનલ ॥ ફાજલ ॥ હાલતો ॥
લાઅલાહા ॥ ઈલલલલાહા ॥ સુભાનલ
રહમાનોર ॥ રહીમો ॥ લાઅલાહા ॥

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

(८)

લલલલાહો સુભાનલ ॥ કાદર લાગે
હૈં ત દરો: ભાઈ લાહાં ઇલલલાહો
સુભાનાજલ ॥ ગુફરાજલ ॥ ભાઈ
લાઈલહાં ॥ ઇલલલાહો ॥ સુભાન
લ નાલે ફલ ॥ ગુલફ: ભાઈ લાહાં
ઇલલલાહો ॥ સુભાનલ ॥ બારી ફલ
ના સલ પે રો ॥ ભાઈ લાહાં ઇલલ
લલાહો ॥ સુભાનલ ॥ સાજનુલ બખ
બારો ॥ ભાઈ લાહાં ઇલલલાહો સુ
ભાનલ ॥ નબ બારુલ જુતે ફબબારો ॥

લો શ્રી લોહાં ઘેલલલલોહો સુજાનલ
લોહો જ્ઞ ન નાં ચસે ફુલ લો શ્રી લો
હાં ઘેલલલલોહો સુજાનલ લ ફુંદુ
સોસ સુખ ખુ હો લો શ્રી લોહાં ઘેલલ
લલોહો સુજાના રખખુ ન લો ઝઉ
તી ઠ પર રૂ હો લો શ્રી લોહાં ઘેલલલ
લોહો સુજાના નલ આલો ઝીલન
ન યા ના શ્રી લો શ્રી લોહાં ઘેલલલલ
હો સુજાનલ નલ ફુલ મ ફુ સુ ઇ લો
શ્રી લોહો ઘેલલલલોહો સુજાનલ
ઠનનોઝલ જાનના નો લો શ્રી લોહાં

૯

ઇલલલલાહાં સુભાનલ: આદમ:સ

ફીઉલ લાહ: લાઅ લાહાં ઇલલલલા

હા નુહ નજીઉલલાહ: લાઅ લાહાં ઇ

લલલલાહા ઇબરાહીમ: ખલીલ લુલ લાહ:

લાઅ લાહાં ઇલલલલાહા ઇસમાઇલ

ઝબીઅલ લાહ: લાઅ લાહાં ઇલલલ

લાહા મુસા કલીમ લુલાહ: લાઅ લાહાં

ઇલલલલાહા ઇસા રુહુલ રુહુલ લાહ:

લાઅ [illegible] હ: ઇલાલલાલા મા: ઇ ૨૦

૩ સુ લલા મ: લાઅ લામા: ઇલાહુલલાહ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

યા કુરેસા અલૉહ:॥ અસસલાતો॥ વસ

લામો॥ અલૈકા યા॥ મદની અલૉહ:

અસસલાતો॥ વસૉલામો॥ અલૈકા યા॥

મની ખ તારૂલૉહ:॥ અસસલાતો॥ વસૉ

લામો॥ યાલૈકા॥ યા॥ મન અન મલુલૉ॥

અસસલાતો॥ વસૉલામો॥ અલૈકાયા॥ ખલ

ખલુ લૉહ: અસસલાતો॥ વસૉલામો॥

અલૈકા યાં હુનર કુલલૉહ॥ અસસલા

વસૉલામો॥ અલૈકા યાં॥ સખ બલુલૉહ

અસસલાતો॥ વસૉલામો અલૈકા યા

કુલતલૉહ

(૧૧)

અસસલાતો વસૌલામો અલેકાંયાં રહેમ
નુ જોહે॥ અસસલાતો વસૌલામો અલેકાં
યાં નુરલ લાહે॥ અસસલાતો વસૌલામો
અલેકાંયાં મહમદરસુલ લોહે॥ અસ
સલાતો વસૌલામો અલેકાંયાં સાહેબાન
લાત॥ અસસલાતો વસૌલામો અલેકાં॥
યા સાહેબાલ હાન વલ ફા સસા અ
સસલાતો વસૌલામો અલેકાંયા સા
હેબાસ સપફા અતન॥ અસસલાતો
વસૌલામો અલેકાંયા સાહેબાન
ન્યામત॥ અસસલાતો વસૌલામો॥

ગા કુરેસા અલૉ હિ: અસસલાતો પસૉ
લાગો અલૈકાં યાં ગફલી અલૉ હિ:
અસસલાતો પસૉલાગો અલૈકાં યા
ગની ખતાઝુલૉ હિ: અસસલાતો પસૉ
લાગો યાલૈકાં યાં મન અનગતુલૉ
અસસલાતો પસૉલાગો અલૈકાં યા ખલ
ખતુ લૉ હિ: અસસલાતો પસૉલાગો
અલૈકાં યાં હુનરતુલલૉ હિ અસસલા
પસૉલાગો અલૈકાં યાં સખફળતુલૉહિ
અસસલાતો પસૉલાગો અલૈકાં યાં
કુલૅતલૉહિ

(૨૯)

અસસલાતો વસૌલામો અલેકુંયાં રહેમ
ઉલાંહે ॥ અસસલાતો વસૌલામો અલેકું
યાં નુરલલાહે ॥ અસસલાતો વસૌલામો ॥
અલેકુંયાં મહમદરસુલલાહે ॥ અસ
સલાતો વસૌલામો અલેકુંયાં સાહેબાન
તાન ॥ અસસલાતો વસૌલામો અલેકું ॥
યા સાહેબીલ હોજે વલ ફોસસા અ
સસલાતો વસૌલામો અલેકુંયા સા
હેબાસ સફા અતન ॥ અસસલાતો
વસૌલામો અલેકુંયા સાહેબીન
બાયતે ॥ અસસલાતો વસૌલામો ॥

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

(૧૨)

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

વરસ ॥૬॥ રુજુ જિઅરજુ ॥:॥ ૭ ॥ આગલે
જાન જિન્નમાન તખેતો ॥:॥ દના ॥૨૨॥ ૫
છ ગાત ॥:॥ દનર૬ ॥ ગાત ॥ વરસા ॥ ૨૭ ॥
નખાંઉ ॥ પછ ગાત ॥ વરસા ॥ ૩૮ ॥ રુજુ જિ
અરજુ ॥:॥ ૮ ॥ જ ગાન જિન્નમાન તખેતો
દના ॥ ૨૧ પછી ગાત ॥ વરસા ॥ ૨૪ ॥ વરસ
૨૬ ॥ વરસા ॥ ૨૮ ॥ વરસા ॥ ૨૫ ॥ વરસા ॥
૨૭ ॥ વરસ ॥ ૬૦ ॥ પ જિઅરજુ ॥ ૯ ॥
પુરવ પાલ ગંગા જિન્નમાન તખેતો ॥

ધન ॥ ૫ ॥ [illegible] ॥ [illegible] ॥

વરસ ॥ ૨૫ ॥ વરસ ॥ ૬૦ ॥ [illegible]

[illegible]

ધન ॥ [illegible] ॥ વરસ ॥

૧૬ ॥ વરસ ॥ [illegible] ॥ [illegible]

[illegible] ॥ ૨૨

વરસ ॥ ૧૧ ॥ વરસ ॥ ૧૬ ॥ વરસ ॥ ૫૭ ॥

વરસ ॥ ૬૦ ॥ વરસ ॥ ૬૨ ॥ [illegible]

[illegible]

સા ॥ ૭ ॥ વરસ ॥ ૧૦ ॥ વરસ ॥ ૨૦ ॥ વરસ ॥ ૬૦ ॥

પર દુ સંગરી ॥ ૧૭ સાંચા તનજી નામાન
અંતાં ॥ દના ॥ ૭ ॥ ના ॥ ચુ ॥ ૬ ॥ વરસા ॥ ૨૬ ॥
વરસા ॥ ૩ ૭ ॥ વરસા ॥ ૮ ॥ પર દુ સંગરી ૧૭
પર્શીંજા ન જી નામા ન ન ગીતાં દના ॥ ૬ ॥
મા ૧૨ ॥ ૬ ॥ ના સા ॥ ૨૦ ॥ વરસા ॥ ૧ ॥ વરસ
૧૫ ॥ વરસા ॥ ૬૦ ॥ વરસા ॥ ૮૦ ॥ ૨૩ જોધ
ર ૩ ॥ ૧૭ ॥ ગુરુ ધાન જી નામાન ન
અંતાં ॥ દના ॥ ૩ ॥ માસ ॥ ૨૬ ॥ વરસ
૧૬ ॥ વરસા ॥ ૧૮ ॥ વરસા ॥ ૩૦ ॥ ૨૪ જોધ
ર ૩ ॥ ૧૭ અંગરા જી નામાન ન ગીતાં દના ॥ ૧
દના ॥ ૧૬ ॥ દના ॥ ૨૦ ॥ વરસા ॥ ૩૨ ॥ વરસ

[illegible] ॥ ધન ૨૮ ॥ ભરત ॥ [illegible] ॥ જુગ [illegible]
મા નનની તાં ॥ ધન ॥ ૨૨ ॥ ધન ॥ ૧૫ ॥ બરસ
૫૦ ॥ બરસ ॥ ૫૭ ॥ બરસ ॥ ૮૦ ॥ [illegible]
ભરત ॥ [illegible] ॥ પુરબ [illegible] ડા [illegible] નનની તાં
ધન ॥ ૫ ॥ મા [illegible] ॥ ૧ ॥ [illegible] ॥ ૮ ॥ [illegible]
॥ બરસ ॥ ૧૬ ॥ બરસ [illegible] ૨૦ ॥ બરસ [illegible] ॥ ૨૫ ॥
બરસ ॥ ૮૦ ॥ [illegible] ડા ભરત ॥ [illegible] ॥
[illegible] ડા [illegible] નનની તાં ધન ॥ ૬ ॥ [illegible]
ધન ॥ ૨૦ ॥ બરસ ॥ ૨૬ ॥ બરસ ॥ ૨૦ ॥ બર
સ ॥ ૨૫ ॥ બરસ ॥ ૮૦ ॥ [illegible] ભરત [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ષરશ॥ ૬॥ વરશ॥ ૩૩॥ વરશ॥ ૩૫॥
વરશ॥ ૪૫॥ પા॥ ઙુત ઑનરઙઃ ❀ ॥ ઉતા
ના દરપતતજ નપાનનખતો ॥ ૩૫ તા
૪॥ વરશ॥ ૯॥ વરશ॥ ૨૫॥ વરશ॥
૪૩॥ જપદ્દેશેનરઙ ❀ ॥ ૨૫ તાનજે
નપાનનખતો ૪૦॥ ૬॥ ૫૬॥ ૩॥ વરશ
૨૨॥ વરશ॥ ૫૦॥ વરશ॥ ૬૦॥ ૩૩ જે
નરઙઃ ❀ ઑતસરાગાનજશરપુરષાદ ❀
❀ ॥ ગાજ નપુનાંરસુજાપનાનઙઃ
રવાવારેના॥ ગરવલતજુપાનબાજુ

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com

नादपुरस्स गः॥ नुपानेरजाः

न[illegible]लजाः॥ नपादुः नापादाः

[illegible] श्री स्मगः॥ मगलगः पर त

तः जुमा स्मनगः जुमा स्मनादगः

स्मापदुपाः पदारजैमानः मा ना

तनगः परीजमाः मलरजुरना

छेस्सपरदुरनास्मिगः [illegible] पदाप

री जुमाः र गुपदारगतः परदण

गः परण दुपास्सनुः जुरमपदे

शपान्नः स्मतापरी जुमनाः

परमेशरगा॥ परमपरजा॥ परी जुगा

मा॥ पर लाजे ते पत गी॥ तु तां स्नगा॥

प जोते नः पछी श्री हीपा॥ वे हीपर

जुग मा॥ र गु पंही गनी आपरी पुरुष

पा लुगरवं हत्वा सनी॥ सहुग

सहुग॥ सहु दार गा॥ वे हवापसेहु

स जेर जुग मा॥ वनु ताप मनुता

त॥ जेर ले जो सगा॥ पही परतत

पर ल जे त पत गा॥ परमेशरगा॥

परी जुगमा॥ तु परे जीवे धां॥

२१

[illegible] परमेश्वरगा: [illegible]

पर[illegible] परमे पर [illegible] दीपा

[illegible] दीपर

[illegible]श्वरगा [illegible] पर [illegible]

[illegible] दीपरमेश्वरगा:

पर [illegible]

[illegible] पर [illegible]

[illegible] ॥ ❀ ॥

[illegible]

[illegible]

[illegible] परमेश्वर [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

सगा: पे भा–आगा:॥ मदी तो कुरबी ना
पर जरमा भा: –अशल भे शिपा भ
गा:॥ नमो शिरपीनापरा जुगा:॥
परमेशरगा:॥ परजुग मा: –पप
रवदी गां जिवा अपुरस छि
भरत जिर: ए आपर वता:॥ पर
मसु जोगा:॥ दीप श्रदीपां नाजु
दीपं:॥ फिर फिरलपा नगा:॥ परमे
जुगा–आमी:॥ –पवगादीक्षा:॥
कुपार कीजे न: असल गागाशल
जुजेगा:॥ वजुतनगरे: दीराकुवमे

नवे तगा॥श्वरस्वताजा का॥शाजर

मता‍ऋशरि॥ नवघ माजुजरि॥

ईयापमनदा शरघाने॥दे शतेत्रा

गा॥शरु बाले नन गा॥श्वत्रुपा

जुजा बाग्वे ढ्रि॥ गोनाराजवमने॥

दुलेलो गत्वते॥ जुघशा सत्रे॥

दुरावरदुं॥ शजावरतगादस्वा॥

श्रुरनश्रु गा॥गा॥गाजगाजगा॥

फ्रकसापदेदेगा॥गाश्रीदीवश्री॥

नवाजारि नजेत्र॥ दुराद रकी॥

रव्यापना॥पं॥ कारणं॥॥ अपते

॥पशुतं कंउपनतं॥ तकं मकी॥ना

रा मागा॥पशं जुमा॥॥ आदं॥ओ

नादिं उपनतं॥ परंमत गा॥

जिं॥ मा॥ना कं मजुगं करतत गा॥

ताराकागा॥ नापा शं स्तावापतं॥

तदातं का कोतवगा॥ शंवामा

तगा॥ उपनतं छे लो श्रीं॥

तकं मकी ना मकागा॥पर जुमा

समापतं शतपुरकागा॥ ❀ ॥ श्री

શ્રી સતગોર બ્રમા વાચા ગ
નાંનુ ખોલખીએ છે ॥

જરે સતગોર બ્રમાને ઓલ
ખ્યા ॥ મેં તો સુરતીસું કરી પર
ણામ રે ॥ હરીરસ પામીઆં ॥
૧ ॥ જરે બ્રમા રસ લાગે માહડો
॥ મારે અંગે ઉલટ નાં માઅરે
॥ હરીરસ પામીઆં ॥૨॥ જરે
જોત પરકાસી ને તેજકરા ॥ તેતો
નુર માંહે નુર સમાઅરે ॥ હરીર
સ પામીઆ ॥૩॥ જરે અખંડ જો

(૨૫)

તત્તીઆનલહલે ॥ નાંમીકુમલં
થાકીધોવાસતારરે ॥ હરારસ
પામીઆં ॥૪॥ ઝરે આરફલા
અમરરસ કુઇએ ॥ મેતો પરસંગ
દીઠાનુંરરે ॥ હરીરસ પામીઆં ॥
પા ॥ ઝરે સોલ કુલાં વીસનવનર
કુઇએ ॥ તેતો જોત માંહે જોત
સમાઅરે ॥ હરારસ પામીઆ
॥ ઝરે પાંમ તતવનાકુઆકુ
રી ॥ નવખંડ માંહે કીધો પરકાસ
રે ॥ હરીરસ પામીઆં ॥૫॥ ઝરે

જુગમાંહે ગોરનર જી આવીઆ
॥ સેવક લોકોને દેવા દીદાર રે ॥ હ
રીરસ પામીઆ ॥૯॥ જી રે સંત પંથ
સોહ કુળાનાં એણો ॥ તે તો પેખી આં
તે સુરજ કેવા અસરે ॥ હરીરસ પામી
આં ॥૧૦॥ જી રે ઈગળા પીંગળાને
સુખમના ॥ તે તો ચડી ગઆ ત્રવે
રણી ઘાટ રે ॥ હરી રસ પામીઆં
॥૧૧॥ જી રે શ્રીકુટી સંગમના ઘ
એ ॥ તે તો દસમે પામઆ દીદાર રે
હરી રસ પામીઆં ॥૧૨॥ જી રે દસ

(૨૫)

મેતો દુવારે જઈ મીલઆ ॥ તેતો
પામા આછે અંમરપદ રે ॥ હરીર
સ પામીઆં ॥ ૧૨ ॥ જરે અેમ બો
લઆ ગોર ઈમામ સા ॥ મારા
મુનીવર ને વઈ ફીટ નાંવા સરે
॥ હરીરસ પામીઆં ॥ ૧૩ ॥
સ્રી સતગોર બ્રમાં વાચા ધી
ણ લ ખ્યા છે ગનાંન ધી ॥
સાવામી પદા દુસાની પત રાખ
જો ॥ ભવસાગર ઉતારો ને પાર રે
॥ સતગુરુ તમને વીનવું ॥ ૧ ॥

સામીયાંતાઅમારારાખજો ॥ કરો
ડીઅનતજુવે છેવારરે ॥ સતગરૂ
હુતમનેવાનવું ॥૨॥ બત્રીસદાં
તવચેજભરાખા ॥ તેમઅમને
ઉગારીલેજોરે ॥ સતગરૂ ॥૩॥
પેલાકુરતાજુગમાં હરીઆવા
આં ॥ કરોડી પાંચઉતારાઆ
પારરે ॥ સતગરૂ ॥૪॥ રાજાપ
રલાજનાવારેહરીઆવીઆં ॥
નરસાંહીરૂપે છો મહારાજરે ॥
સતગરૂ ॥૫॥ બીજાત્રેહેતાજુ

ગમાંહરીઆવીઆ॥ કરોડીસા
ત ઉતારાં પારરે॥ સતગરૂ હે॥
॥૬॥ રાજા હરીસંદ્રનીવારેતમે
આવીઆ॥ રામાજી રૂપે છો મહા
રાજરે॥ સતગરૂ॥૭॥ તાજાદેવા
પુરજુગ માંહરીઆવીઆ॥ કરોડી
નવઉતારા પારરે॥ સતગરૂ॥૮॥
રાજા જુજેસટલનીવારે હરીઆવી
આ॥ સ્રીકરસન રૂપે છો મહારાજરે
॥સતગરૂ॥૯॥ દરજોધનનેતમે
તઆથાકા ડીઆ॥ રાણાદરૂપતી

નારાખીછેલાજરે ॥ સતગરૂ ॥૧
માથાકલીજુગમાંહેહરીઆવસે ॥
કરોડીબાર ઉતારાપારરે ॥ સતગરૂ
॥૧૧॥ સુરજારાણીનેગરિરેઘરમઅ
લીઆ ॥ કમલાકુવરનેઆલો
મુગતાનાભેટરે ॥ સતગરૂહુતમને
વીનવું ॥૧૨॥ કમલાકુવર સાર ભર
ણાભરાવસે ॥ નંકલંગા દરસમાં
અવતારરે ॥ સતગરૂતમનેવીનવું
॥૧૩॥ મારાં મહમદસાનીઅરજતમે
સાંભલો ॥ સાહેબ આપેછો મેલારરે ॥

(૨૯)

સતગરૂતમને વાનવું ॥ ૬ ॥ ૭ ॥ ॥ ॥ ॥

ફુરમાનજી ॥ બીસમીલણરે
માનનીરરહીમ ॥ કુલહોવ ॥
લ ॥ લાહો ॥ અહદ ॥ અલાહુ
સ ॥ સમદ ॥ લામી અેલદ ॥ વ
લમી ॥ ઉંલદ ॥ વલમીઅે ॥ કુ
લલહુ ॥ કુફોવન ॥ અહદ ॥
૭ સીંસતગોરબ્રર માં વા મા ઘા
લલખી છે અગમવાણીની

જીરે વધીકુંરનાં થય ઘાફી
આ ॥ સતગોરબ્રમાંજી ॥ આવા

છે આજ ॥ પવીત્ર કુરીઘા આ
ગણા ॥ ૧ ॥ જી રે સતને સામ રણ
દીજે એ સણગા॥મે લા આવી અલ
રાખ્યો ઈ માન ॥ પવીત્ર કુરીઘા
આંગણા ॥ ૨ ॥ જીરે સતન દતમે
લીને દીજે એ॥ખ મે આ સ રીખ્યો
ન હી કુરે ઈદામ ॥ પવીત્ર કુરીઘા
આગણાં ॥ ૩ ॥ જીરે દ સો દ સુ
કુરીતે દીજે એ॥પ છેન પો એ
જી કુરનાં જાપ ॥ પવીત્ર કુરીઘા
આગણા ॥ ૪ ॥ જીરે પ છમ થકી

અલી અડસો॥ મે લોકો સેલંબું
દીપ માંહે॥ પવીત્ર કીધા આ
ગણાં॥ ૫॥ નરનં કુલં ગોલરે
અડસો॥ તે મનાં ઈમામ મે દીધ
ર સે નામ॥ પવીત્ર કીધા આ॥ ૨
૬॥ ૫૬॥ જરે આલ ઈમામ ઘેર
આવી આ॥ તે મનાં નર મહંમદ
સાહેબ નામ॥ પવીત્ર કીધા આં
ગણું॥ ૫ ૭॥ જરે સોલ કુલાતે ઉ
નીસો અતી॥ તે મનાં મુખ પરઝ
લખ્યે છે નુર॥ પવીત્ર કીધા આં

ગણ॥૧૮॥ જીરે આલઈમીંમની
સેવીઆ॥ તેમને સાધીને પડી
આપાઆ॥ પવીત્રકીધાઆગ
ણ॥ ૧૯॥ જીરે આલઈમીમની
પુજઆ॥ તેમનાં પરગટ પુજઆ
પાઆ॥ પવીત્રકીધાઆગણ॥
॥૨૦॥ જીરે આલઈમીંમની આ
લખીઆ॥ દુજરજમાંને પડી
આપાઆ॥ પવીત્રકીધાઆ
ગણ॥૨૧॥ જીરે અનત કરોડવ
રલા વીઓઆ॥ શ્રીઅસલામસાહે

નીવાર ॥ પવીત્ર કુરીઆ આગણા
૮૨॥ જરે અનત કરોડો વર આલ
આ તે મનાં હુસન કુ વારી દીનના
મ ॥ પવીત્ર કુરીઆ આંગણા ॥ ૮૩॥
જરે થાલ ભરો સગ મોતીએ પવ
ધાવોને નં કુલંગીનાંથ ॥ પવી
ત્ર કુરીઆ આંગણા ॥ ૮૪॥ જરે થા
લ ભરો સગ મોતીડ વધાવે તે
સતીઓ ચાર ॥ પવીત્ર કુરીઆ
ગણા ॥ ૮૫॥ જરેસી તાકુતાં નેરા
ણી દરૂપ તી॥ સો થાતેડા વોહરી

મંદ્દનીનારા ॥ પવીત્ર કીધાઆં
ગરણાં ॥૫૨૬॥ ત્રારે મલાકુંવરસી
રછત્રપલી ૫ સત્તી સુરજાદેરાણી
લાવોલીસે ॥ પવીત્ર કીધાઆંગ
ણા ॥ ૨૭ ॥ ત્રારે એમ બોલા ગોર
ઈમામ સા ॥ આજ રવેલાનાંબો
લાછે ઘોલરે ॥ પવીત્ર કીધાઆં
ગણા ॥ ૫૨૬ ॥ સંપુરણ ॥

[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]
[illegible]	[illegible]	[illegible]	[illegible]

[illegible]

૬	૬	૬	૬
૬	૬	૬	૬
૬	૬	૬	૬
૬	૬	૬	૬

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ।। બીસમલાએરરેમાન રરીમા

અલીનીઅરજ લખીછે ।। ઈઆસાએઅલી ।।

૧ ।। સેરેરેઅલી ।।૨।। સાએઅલી ।।૩।।

મરદાનાઅલી ।।૪।। પનાઅલી ।।૫।। અર

ગેઅલી ।।૬।। આયારેઅલી ।।૭।। આગે

અલી ।।૮।। આયારેઅલી ।।૯।। આયા

१अ नेता॥११॥ अनादि ताहा आदि अ ता॥१२॥ आ म

र अ ता॥१२॥ आ छून न रे ला गा अ ता

॥१३॥ अर नै अ ता॥१४॥ आ नारि अ ता॥

१५॥ अन्जम अ ता॥१६॥ अ नर र सं ता

आदि अ ता॥१७॥ अ हुं र हि अ ता ग्वा ता॥

१८॥ अ हुरि वर छ माहिय आ पड़ अ ता॥

॥१९॥ हि अ न ल छ अ ता डी ग ता॥ रे

आ छ मरं ता आदि अ ता॥२०॥ आ न

अ ता॥२१॥ अ र पं अ ता॥२३॥ आ पं अ रि

॥२४॥ आ डीमं ति अ ता॥२५॥ आ जि अ ता

[illegible]

[illegible]

realpatidar.com

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

अकृअमाराा।रंळोउ रणीनमारीा

।।एरनाारा जोमाराा।।२२ नखापिअमामोरारा।

।।२२२ाकृनांअमरापेरााताराा २२२ा छघ

उठआरी।। २२उाहिापिकुरन्नाा।२२२ाअ

उंरकोपराखानारााा।२२पाराामाोह

नमाराा।२छुाापामजुरनदिाराा।२२उ

लिआााड़ाआविाा।२२ाा।।उरनीआाा।

मा६पाराा।।२२१-।।अाापआपुँ रा।आ

रा।आ।ई

१

सोसामीनाहूंहरीनांजनरहीम

तांस्रानाहांदलाहांस्रीनांरामा

गुरांदगीकुनांनां मीलंमालकाम

मनबलाइरमहमेरपरधाः ॥ ॥

रसामीसामीनाहूंरनांनवरहीमरामीम

रहांसीरंनारहीकुपापरपर[illegible]

रहांसांघनांदलांआलोःमांसा

रांपद्मनांनांगुनपइकारहरपान

डिगाार: प्पांडु सांसनकोगाउग

प्पांडु प्पांपनपोर: लां स्रोलां

डांक्राक्रांडी: लालालांक्रा प्पाडु

डुकरा प्पालाक्रो थ्यांक्रामडुम

डेरसूला [illegible] लीलांडां क्राडू पांडु

ताक्षीा

realpatidar.com

[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	[illegible]	


[illegible]


[illegible]

[illegible]

[illegible]

[illegible]





[illegible]

૧	[illegible]	૨	૧૦	
૬	૩	૮	૩	
૧૬	૧૫	૧૪	૩[illegible]	
૯	[illegible]	૧૨	૪	

[illegible] [redacted]

[illegible]

[illegible]

૮	૫	૩	૨	
[illegible]	[illegible]	[illegible]	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	[illegible]	
[illegible]	[illegible]	[illegible]	[illegible]	

[illegible]

[illegible] [redacted]

[redacted]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]


[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]



3

[illegible]

[illegible]

[illegible]

[illegible]


[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]


realpatidar.com

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

From next page onwards...
The book has pages in which the pages have been written from back side and hence upside down.

ગુહીને તોળ મળ ભળમ તારીક

સંવત ૨૦૨૫) ના [illegible] વદ ૧૦ ને

રવીવારના

ભીકુભાઈ નો જન્મ તારીક

સંવત ૨૦૧૭(૯) ના ભાદરવા વદ ૧૦ ને ગુરૂ

ગુરૂવાર ના [illegible]

(૧) ફેમા જાઈ ની જન્મ તારીક

ને ના ૨૦૩૩ ના વૈશાખ વદ ૧૧ ને વાર

સોમે તા: ૨૨-૫-૭૬

(૨૦) મંજુલા ની જન્મ તારીખ લખેલ છે)

ની ના ૨૦૩૮ ના ફાગણ સુદ ૧૦ ને રવી

વારે તા૨-૫-૮૨

[illegible]

સૈયદ-સમસદીન-બાવા સાહેબ

મુ. પીરાણા- નેપરોંમે

દેસ-ગુજરાત-જીલ્લો-અમદાવાદ-

પોસ્ટ-ગ્યાસપુરા-તાલુકે-દસક્રોઈ-

સૈયદ-મુરાદઅલી બંદેઅલી નેપરોંમે-

મુ. અવાખલ-પોસ્ટ-અવાખલ-

વાયા-મીયાગામ-સ્ટેશન-સાધલી

દેસ-ગુજરાત-

સૈયદ-અબાસઅલી-મુરાદઅલી-

દુધાળે-ગંભલ-અરજી લખ્યા-
ઈરૂદે-અત્બર લખ્યા-બાલીરલ-
ગુજરાતી-અક્ષરોમાં મંગાવાનું-
સરનામું-લખ્યું છે
મુ-અમદાવાદ-વડુંલ-જુકડીપો
મોરમદબલ-રોડ
લીલ-દરવાજા-અમદાવાદ-

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

~~[illegible]~~

[illegible]

[illegible]

लाखा रामनके देखुने ग

~~इगगोनानने भोधेतेमा~~

धानदुनावेछे

~~स्वत १९८८ नाये रोइ रुइ~~ १२ ने

~~पारेगदू नारों~~ जे पडीस

~~नाजे धागाने कुमारने मेंडो~~

छे लाखा सोनलदूधलजे गरे

गडीतेलदानदूखे

ग्रहनी आनें रजध्या रें ये

फेराजपीने खाअना पी प

मानापाइ माडुड ग्रौधा नें से

डेसो पासनें ग्रेवधानें रें

रेप धावीनें फछनमपुनें

वीखोपजेंडुरा जपी

नें खोननरजइ मानें इप

तेमनेंइरपी

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

realpatidar.com


realpatidar.com
realpatidar.com


realpatidar.com
realpatidar.com